

## LANGUAGE SERVICES AVAILABLE

### Arabic

ملحوظة: إذا كنت تتحدث اذكر اللغة، فإن خدمات المساعدة اللغوية تتوافر لك بالمجان. اتصل برقم 1-800-735-2989 (رقم هاتف الصم والبكم: 1-210-289-7675).

### Chinese

注意：如果您使用繁體中文，您可以免費獲得語言援助服務。請致電 1-210-289-7675 (TTY: 1-800-735-2989)。

### Farsi

توجه: اگر به زبان فارسی گفتگو می کنید، تسهیلات زبانی بصورت رایگان برای شما فراهم می باشد. با 1-210-289-7675 تماس بگیرید. (TTY: 1-800-735-2989)

### French

ATTENTION : Si vous parlez français, des services d'aide linguistique vous sont proposés gratuitement. Appelez le 1-210-289-7675 (ATS : 1-800-735-2989).

### German

ACHTUNG: Wenn Sie Deutsch sprechen, stehen Ihnen kostenlos sprachliche Hilfsdienstleistungen zur Verfügung. Rufnummer: 1-210-289-7675 (TTY: 1-800-735-2989).

### Gujaranti

સુચના: જો તમે ગુજરાતી બોલતા હો, તો નિ:શુલ્ક ભાષા સહાય સેવાઓ તમારા માટે ઉપલબ્ધ છે. ફોન કરો 1-210-289-7675 (TTY: 1-735-2989).

### Hindi

ध्यान दें: यदि आप हिंदी बोलते हैं तो आपके लिए मुफ्त में भाषा सहायता सेवाएं उपलब्ध हैं। 1-210-289-7675 (TTY: 1-800-735-2989) पर कॉल करें।

### Japanese

注意事項：日本語を話される場合、無料の言語支援をご利用いただけます。1-210-289-7675 (TTY:1-800-735-2989) まで、お電話にてご連絡ください。

#### Korean

주의: 한국어를 사용하시는 경우, 언어 지원 서비스를 무료로 이용하실 수 있습니다. 1-210-289-7675 (TTY: 1-800-735-2989)번으로 전화해 주십시오.

#### Lao

ໂປດຊາບ: ຖ້າວ່າ ທ່ານເວົ້າພາສາ ລາວ, ການບໍລິການຊ່ວຍເຫຼືອດ້ານພາສາ, ໂດຍບໍ່ເສັຽຄ່າ, ແມ່ນມີພ້ອມໃຫ້ທ່ານ. ໂທ 1-210-289-7675 (TTY: 1-800-735-2989).

#### Russian

ВНИМАНИЕ: Если вы говорите на русском языке, то вам доступны бесплатные услуги перевода. Звоните 1-210-289-7675 (телетайп: 1-800-735-2989).

#### Tagalog

PAUNAWA: Kung nagsasalita ka ng Tagalog, maaari kang gumamit ng mga serbisyo ng tulong sa wika nang walang bayad. Tumawag sa 1-210-289-7675 (TTY: 1-800-735-2989).

#### Urdu

خبردار: اگر آپ اردو بولتے ہیں، تو آپ کو زبان کی مدد کی خدمات مفت میں دستیاب ہیں۔ کال کریں 1-210-289-7675 (TTY: 1-800-735-2989).

#### Vietnamese

CHÚ Ý: Nếu bạn nói Tiếng Việt, có các dịch vụ hỗ trợ ngôn ngữ miễn phí dành cho bạn. Gọi số 1-210-289-7675 (TTY: 1-800-735-2989).